https://archive.org/details/bk1400/page/n0/mode/1up

2010-08 -Patidar Saurabh (1400)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

https://archive.org/details/bk1400/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1400/page/n2/mode/1up

2010-08 -Patidar Saurabh (1400)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:53:08 +05'30'



Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1400/page/n3/mode/1up

realpatidar.com

#Sanatan Dharm Jagruti start #History

તંત્રીલેખ

સનાતન હિન્દુ સમાજ તરફનું વિરાટ કદમ

કેન્દ્રીય સમાજે શ્વેતપત્રની જાહેરાત કરી સમાજની ધાર્મિક બાબતની નીતિ સ્પષ્ટ કર્યા બાદ સમાજની અસાધારણ સામાન્ય સભા અને પંચમ અધિવેશનમાં લોકોએ આપેલ જબરદસ્ત ચૂકાદાને સ્વીકારી તેનો અમલ કરવા કેન્દ્રીય સમાજે આદેશ બહાર પાડતાં સમગ્ર સમાજમાં સનાતન હિન્દુ ચેતનાનું મોજું ફરી વળ્યું છે.

સનાતન હિન્દુ ધર્મ પાળતા હોય અને સમાજના જ્ઞાતિ રીત રિવાજોને લગતા નિયમ નંબર ૧૮ અને ૧૯નો સ્વીકાર કરતા હોય તેવા લોકો જ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્ય તરીકે રહી શકશે તેવી સ્પષ્ટ જાહેરાત કેન્દ્રીય સમાજે દરેક ઝોન સમાજોને તા.૧-૭-૧૦ના પાઠવેલ પત્રમાં કરતાં સમાજ તેની મૂળ સનાતની વિચારધારા તરફ પાછી ફરી રહી હોવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

કેન્દ્રીય સમાજના હવે પછી થનારા આજીવન સભ્યો અને વર્તમાન ૧૭ હજાર સભ્યો માટે પણ ઉપરોક્ત વિચારધારાનો સ્વીકાર ફરજિયાત બનાવાયો છે. એટલે બીજી રીતે જોઈએ તો અત્યાર સુધી વિવાદ જગાડનાર નિયમ ૧૮ અને ૧૯નો અનાદર કરનાર વ્યક્તિ માટે હવે આપણા સમાજમાં કોઈ જ સ્થાન નથી તે સ્પષ્ટ થઈ ગયું છે.

ભારતભરની ૨૯ ઝોન સમાજોને આ આદેશનો અમલ કરવા કેન્દ્રીય સમાજે લેખિતમાં જણાવી દીધું છે અને કેટલીક સ્થાનિક સમાજોએ તેના અમલ તરફની દિશામાં ડગ માંડી પણ દીધા છે ત્યારે ભારતભરમાં આ આદેશનો વ્યાપક અને ત્વરીત અમલ થાય અને વરસોથી સમાજને કોરી ખાતી એક સમસ્યાનો અંત આવે તે જરૂરી છે. યુવા સંઘે પણ તેના દરેક ઝોનને સમાજના આદેશનો અમલ કરવા જણાવી દેતાં તેનો અમલ પણ યુવા બ્રિગેડે શરૂ કરી દીધો છે.

કેન્દ્રીય સમાજના શ્વેતપત્રની જાહેરમાં હોળી કરનાર અને સ્વર્ણિમ મહોત્સવમાં ખલેલ પાડવાનો પ્રયાસ કરનાર સમાજ વિરોધી તત્ત્વોની સાન ઠેકાણે લાવવા જ્ઞાતિજનોની વ્યાપક લોકલાગણી છે ત્યારે આ ગંભીર ગુનો આચરનાર સભ્યો વિરુધ્ધ કડકમાં કડક પગલાં કેન્દ્રીય સમાજ ભરે તે જરૂરી બની ગયું છે.

કેન્દ્રીય સમાજે શ્વેતપત્ર અને તા.૧-૭-૧૦ વાળા આદેશથી તેની નીતિ સ્પષ્ટ કરી દીધી હોવા છતાં 'દૂધ અને દહીંમાં પગ' રાખનારા કેટલાક આગેવાનોને કારણે સમાજમાં જબ્બર ગૂંચવાડો પ્રવર્તી રહ્યો છે. જવાબદાર આગેવાનોની નાદાન હરકતોને કારણે કેન્દ્રીય સમાજને પણ ક્યારેક મૂંઝવણમાં મુકાવું પડે છે ત્યારે આવા લોકો પર પણ જરૂરી લગામ કેન્દ્રીય સમાજ લગાવે તેવી પ્રબળ લોકલાગણી દેશભરમાં પ્રવર્તી રહી છે.

શ્વેતપત્રની જાહેરાત બાદ નિરોણા, ઘડાણી વિસ્તારના કેટલાક સભ્યો સમાજના મૂળ પ્રવાહમાં પરત ફરી રહ્યા છે ત્યારે આવા પાછા ફરતા સભ્યોનું સનાતન સમાજમાં ઉષ્માભર્યું સ્વાગત થાય તે જરૂરી છે. ઉત્સાહના અતિરેકમાં ક્યાંક સનાતનીઓ દ્વારા આવા સભ્યોની બીનજરૂરી કોચવણ ન થાય તે પણ એટલું જ જરૂરી છે.

સમગ્ર સમાજમાં નવા સૂર્યોદયના મંડાણ થઈ રહ્યા છે ત્યારે કેટલીક બાબતોને નજર અંદાજ કરવામાં જ શાણપણ છે. આ શાણપણ અને ગંભીરતા સમાજના દરેક સભ્યો કેળવે અને એક નવા સનાતન હિન્દુ સમાજના ઘડતરમાં અગ્રિમ યોગદાન આપી સ્વર્ણિમ વર્ષની ઉજવણીને સાર્થક બનાવે એવી સૌ જ્ઞાતિજનો પાસે અપેક્ષા છે.

■

realpatidar.com

realpatidar.com

આદેશ

Only Sanatani can become member of ABKKP Samaj #History

કેન્દ્રીય સમાજે શ્વેતપત્ર બાદ બહાર પાડેલ બાજા આદેશ

કેન્દ્રીય સમાજના સભ્ય બનવા માટે હિન્દુ સનાતની હોવું ફરજિયાત

સનાતન હિન્દુ ધર્મ પાળતા હોય અને સમાજના જ્ઞાતિ રીતરિવાજોને લગતા નિયમ નંબર ૧૮ અને ૧૯નો સ્વીકાર કરતા હોય તેવા લોકો જ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્ય તરીકે રહી શકશે તેવી સ્પષ્ટ જાહેરાત કેન્દ્રીય સમાજે કરી છે.

Existing members of ABKKP Samaj will have to re-apply for membership #History

[illegible] જ આજીવન [illegible] જના પ્રમુખ [illegible] રાણી અને [illegible] વજી ધોળુએ [illegible] ત્રમાં જ્ઞાતિના [illegible] આ આદેશ આપવામાં આવ્યો છે.

સમાજના નવા થનાર આજીવન સભ્યો ઉપરાંત વર્તમાન આજીવન સભ્યોને પણ આ આદેશ લાગુ પડશે. કેન્દ્રીય સમાજના હાલે ૧૭ હજાર જેટલા આજીવન સભ્યો છે તેમને દરેકને વાર્ષિક સામાન્ય સભાના સરક્યુલરની સાથે આજીવન સભ્યોએ ભરવાનું અરજીપત્રક પણ મોકલી આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય સમાજે તૈયાર કરેલ આ અરજીપત્રકમાં વર્તમાન આજીવન સભ્યોએ સ્પષ્ટ રીતે દર્શાવવાનું છે કે "મેં બંધારણ અને ધારાધોરણના નિયમો વાંચ્યા છે તે મને માન્ય છે. હું સમાજના જ્ઞાતિના રીત રિવાજોને લગતા નિયમોમાં નિયમ નં. ૧૮ અને ૧૯ને સ્વીકારું છું. હું જાણું છું કે આ નિયમોનો ભંગ થયેથી સમાજ મારો બહિષ્કાર કરી શકે છે તેમજ મારું સભ્યપદ રદ થઈ શકે છે."

આજીવન સભ્યના ઉપરોક્ત સ્વીકાર સાથે સ્થાનિક સમાજની ભલામણ પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આજીવન સભ્યો તરફથી મળેલ આ અરજીફોર્મ કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં માન્યતા માટે રજુ કરવામાં આવશે અને બેઠકમાં માન્યતા આપવા માટે જે કંઈ નિર્ણય લેવામાં આવશે તે દરેકને બંધનકર્તા રહેશે.

કેન્દ્રીય સમાજે શ્વેતપત્ર જારી કરતી વખતે જ તેના અમલની જવાબદારી જે તે સ્થાનિક સમાજ પર નાખી હતી. કેન્દ્રીય સમાજે હવે તેના આજીવન સભ્ય માટે શ્વેતપત્રમાં જણાવેલ વિગતનો અમલ શરૂ કરી દીધો છે ત્યારે સ્થાનિક સમાજો પણ તેનો અમલ કરે તે માટે સમાજ દ્વારા તા.૧-૭-૨૦૧૦ વાળો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાય છે.

નવા થનાર સભ્યો સહિત વર્તમાન ૧૭ હજાર જેટલા આજીવન સભ્યોને પણ આ આદેશ લાગુ પડશે

સનાતનીઓની ચળવળને મળેલ જબ્બર સફળતા

કેન્દ્રીય સમાજ બાદ દરેક ઝોન અને સ્થાનિક સમાજોમાં પણ આદેશનો અમલ શરૂ

ઉપરોક્ત આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તા.૭-૫-૨૦૧૦ના રોજ મળેલ સમાજની અસાધારણ સામાન્ય સભામાં અને તા.૧૨-૫-૨૦૧૦ના રોજ યોજાયેલ જ્ઞાતિના પંચમ અધિવેશનમાં જ્ઞાતિ રીતરિવાજ અને ધાર્મિક વહેવાર સંબંધે સૌનો સ્પષ્ટ મત રહ્યો છે ત્યારે પસાર કરેલ બાહ્ય અને આંતરિક આચરણો અને નિયમો દરેક ઝોન અને સ્થાનિક સમાજોમાં ગંભીરતાપૂર્વક પળાય તે માટે કેન્દ્રીય સમાજે ઉક્ત આદેશ દ્વારા ધ્યાન દોરેલ છે.

આ આદેશપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૧૯૬૦ની સમાજ રચના વખતે અને આજ પર્યંત મળેલ સમાજના અધિવેશનો ઉપરાંત સમાજની સભાઓમાં પણ જ્ઞાતિનાં બાહ્ય આચરણો હિન્દુ સનાતન વૈદિક પરંપરાના હોય તેવી જાગૃતિ અને જનમત વ્યક્ત થતો જ રહ્યો છે જેનું સમર્થન અને અનુમોદન હરહમેશ આપણે કરતા આવ્યા છીએ.

કેન્દ્રીય સમાજે આ આદેશમાં સ્પષ્ટ જણાવેલ છે કે આપણે રીતરિવાજ અને ધાર્મિક બાબતે સંપૂર્ણ સ્પષ્ટ હોઈ જન્મથી મરણ સુધીના સોળ સંસ્કાર અને હિન્દુ આચરણો હાલનો બહોળો સમુદાય પાળે જ છે તે મુજબ દરેકે પાળવાનું-વર્તવાનું રહેશે.

સમાજના સભ્ય તરીકે કેવી વ્યક્તિ રહી શકશે તે બાબતે આદેશમાં જણાવેલ છે કે સનાતન વૈદિક હિન્દુઈઝમ વિચારધારાને અનુસરતા હોય તે વ્યક્તિ કે સમુદાય કેન્દ્રીય સમાજ અને તેને સંલગ્ન સંસ્થા સમાજોમાં સભ્ય તરીકે રહી શકશે. સમાજના સુધારેલા નવા બંધારણ અને જ્ઞાતિના રીતરિવાજોના નિયમ વિરુધ્ધ વર્તન કરનાર વ્યક્તિ કે સમૂહ સમાજના સભ્ય તરીકે રહી શકશે નહીં તેમજ સમાજના આયોજનો અને કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે નહીં.

૧૯૬૦માં કેન્દ્રીય સમાજની રચના વખતે વડીલોની ઉદાર નીતિને ધ્યાનમાં રાખી સમાજના મુખ્ય પ્રવાહમાં બદલાવની અપેક્ષાએ સૌને જોડવાનો પ્રયાસ હતો. વર્તમાન સઘળી હકીકતોનો અભ્યાસ કરતાં અને જ્ઞાતિજનોનો ઉત્સાહ, લાગણી ધ્યાને લેતાં સ્વર્ણિમ કાર્યક્રમોમાં સર્વના આદેશ પ્રમાણે જ્ઞાતિજનોએ પસાર કરેલ સુધારા સંબંધે વર્તવાનો કેન્દ્રીય સમાજે આદેશ કરેલ હોવાની વાત પણ પત્રના અંતે કરવામાં આવી છે.

કેન્દ્રીય સમાજે આ આદેશ મુજબ તમામ બાબતોને અનુસરીને સ્થાનિક સમાજ, સંસ્થા, ઝોન વિગેરેના બંધારણમાં જરૂરી ફેરફાર કરી તેની નકલ કેન્દ્રીય

realpatidar.com

https://archive.org/details/bk1400/page/n5/mode/1up

2010-08 -Patidar Saurabh (1400)

realpatidar.com

સમાજને મોકલી આપવા પણ દરેક ઝોન સમાજોને અનુરોધ કર્યો છે.

કેન્દ્રીય સમાજના ઉપરોક્ત તા.૧-૭-૨૦૧૦વાળા આદેશની નકલો દેશભરની ઝોન સમાજ અને આજીવન સમાજોમાં પહોંચી જતાં કેટલાક ઝોનમાં તો આદેશ મુજબ અમલવારી શરૂ પણ કરી દેવામાં આવી છે. લોકો તરફથી કેન્દ્રીય સમાજના આ આદેશનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઉમળકાભેર તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સમાજના ઉપરોક્ત આદેશ બાદ સનાતનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહેલ ચળવળનો વિજય થયો છે. શ્વેતપત્ર જારી કર્યા પછી ખુટતી કડી આ આદેશપત્ર દ્વારા પૂરી થઈ છે ત્યારે હવે સ્થાનિક સમાજો અને ઝોન સમાજો તેનો અમલ કેવી ત્વરાથી કરે છે તે જોવાનું રહે છે.

જો કે કેન્દ્રીય યુવા સંઘે તો તેના દરેક ઝોનને કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર અને આદેશનો અમલ કરવા જણાવી દીધું છે અને ઝોનની નવરચનામાં પણ આ અમલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

કેન્દ્રીય સમાજના મુંબઈ ઝોનમાં પણ થયેલ ઉથલ પાથલ શ્વેતપત્રનું જ પરિણામ હોવાનું જણાય છે. સનાતનીઓનું વર્ચસ્વ મોટાભાગના ઝોનમાં છે ત્યારે તેનો અમલ એટલો મુશ્કેલ તો નથી પણ કેટલી ત્વરાથી થાય છે તે જોવાનું રહ્યું. ❖

સમાજ વિરોધીઓને શું સજા થશે?

કેન્દ્રીય સમાજ દ્વારા જારી કરવામાં આવેલ શ્વેતપત્રની જાહેરમાં હોળી કરી સમાજ વિરોધી કૃત્ય કરનાર સભ્યોને બરતરફ કરવાનો મુદ્દો કેન્દ્રીય સમાજની આગામી કારોબારી બેઠકમાં એજન્ડા પર લેવામાં આવ્યો છે.

આ મુદ્દે કારોબારી કેવું વલણ લે છે અને સમાજ વિરોધી કૃત્યમાં સંડોવાયેલ સભ્યો પર કેવા પગલા ભરે છે તે જોવા તા.૨૪-૮-૨૦૧૦ની કારોબારી બેઠક તરફ સનાતનીઓ મીટ માંડી બેઠા છે.

■ ઊઠો, જાગો ! ઊંઘમાં પડ્યા રહેવાનો આ સમય નથી. જો આજથી જ તમે એમ વિચારવા લાગશો કે તમારામાં પણ અનંત શક્તિ, અપાર જ્ઞાન તથા અદમ્ય ઉત્સાહ રહેલો છે. તો ક્રમે ક્રમે અંતરની તે શક્તિઓને જાગૃત કરતા જશો અને તમે પણ મારા જેવા જ બની જશો.

- સ્વામી વિવેકાનંદ

■ ઉત્તમ સાધ્ય માટે સાધન પણ ઉત્તમ હોવા જોઈએ. સુગંધ ચંદન વગેરે સુવાસિત દ્રવ્યોમાંથી જ મળે છે. કેરોસીન બાળીને હવનની સુગંધ પેદા કરી શકાતી નથી.

- જે. કૃષ્ણમૂર્તિ

અભિનંદન

B.E. (Production) 70%

ચિ. પરેશકુમાર

દામજીભાઈ નાનજીભાઈ જાદવાણી (માતાનામઢ) હાલે શિરોલી (કોલ્હાપુર)ના સુપુત્રે B.E. Production માં 70% સાથે પાસ થઈ પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરવા બદલ અભિનંદન.

B.Com. 83.14%

કુ. કરૂણા કેશવલાલ લીંબાણી

કચ્છમાં મથલ હાલે અલનાવરની સુપુત્રી તથા દામજીભાઈ નાનજીભાઈ જાદવાણી (માતાનામઢ) હાલે શિરોલી (કોલ્હાપુર) વાળાના ભાવી પુત્રવધૂએ B.Com માં 83.14% ગુણ મેળવી સમાજ તેમજ બંને પરિવારનું નામ રોશન કરેલ તે બદલ હાર્દિક અભિનંદન.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 4 of 6
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1400/page/n6/mode/1up

2010-08 -Patidar Saurabh (1400)

realpatidar.com

દક્ષિણ ભારત ઝોનની રચના સતપંથ ઈસ્યુને લઈ મુલત્વી રહી

યુવા સંઘના ભારતભરના ઝોનનું નવરચનાનું કાર્ય પૂર્ણતાને આરે

કેન્દ્રીય યુવા સંઘના દરેક ઝોનમાં આગામી બે વર્ષ માટે નવી કારોબારી અને હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે. મોટાભાગના ઝોનમાં જુલાઈ-૨૦૧૦ દરમિયાન જ આ પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે.

કેન્દ્રીય યુવા સંઘ તરફથી બહાર પાડવામાં આવેલ સમયપત્રક મુજબ જ આ કામગીરી થઈ રહી છે. યુવા સંઘે તેનો કાર્યકાળ બે વર્ષનો કર્યા બાદ ભારતભરના ઝોનમાં આ નવરચનાની કામગીરી પૂર્ણ થવા આવી છે અને દરેક ઝોનમાં નવી વરણી અંગે યુવાનોમાં અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

કેન્દ્રીય સમાજે બહાર પાડેલ શ્વેતપત્ર અને ત્યાર બાદ તા.૧-૭-૨૦૧૦ના જારી કરેલ આદેશ મુજબ કેન્દ્રીય યુવા સંઘે પણ તેના દરેક રીજીયન અને યુવા મંડળોને તેનો અમલ કરવા આદેશ આપતાં યુવા સંઘના ઝોનની નવી વરણીમાં પણ તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

ઝોન રચના અંગે અત્યાર સુધીમાં બહાર આવેલ અહેવાલો મુજબ દક્ષિણ ભારત ઝોન સિવાય તમામ ઝોનમાં નવરચનાનું કાર્ય શાંતિ અને એખલાસભર્યા માહોલમાં આટોપવામાં આવ્યું છે. દક્ષિણ ભારત ઝોનની તા.૧૧-૭-૧૦ના તીરપુર (તામીલનાડુ) ખાતે મળેલ બેઠક સતપંથ-સનાતન વિવાદને લઈ મુલત્વી રહેલ હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ભારત ઝોનનું કોકડું ઉકેલવા યુવા સંઘના અગ્રણીઓ પ્રયાસો કરી રહ્યા છે પણ તામીલનાડુમાં સ્થાનિક માહોલ જોતાં આ પ્રશ્ન જલ્દીથી સુલઝાય તેવો નથી. અન્ય ઝોનમાં જ્યારે સરળતાથી નવી રચનાની કામગીરી થઈ ગઈ ત્યારે તામીલનાડુમાં જ આ પ્રશ્ન કેમ ઉભો થયો તેને લઈને પણ સમાજમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

કેન્દ્રીય યુવા સંઘના નવા પ્રમુખ ગૌરાંગ ધનાણી અને મહામંત્રી હરેશ રામાણી

કેન્દ્રીય યુવા સંઘે તેના દરેક રીજીયન અને યુવા મંડળોને પાઠવેલ એક પત્રમાં જ્ઞાતિના આદ્યસુધારકના ચીલે જ્ઞાતિને એક કરવા યુવાસંઘના કાર્યકરોને ફરજ નિભાવવા અપીલ કરવામાં આવી છે. યુવા સંઘની સ્થાપનાથી જ થયેલ આદેશાનુસાર, વિસરાયેલ પાયાની બાબતને સનાતન સ્વર્ણિમ મહોત્સવના પંચમ અધિવેશનથી ઉજાગર કરી સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરી મુલ્યનિષ્ઠ સંસ્કારીતા જાળવી, જ્ઞાતિનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યો કરવા આ પત્રમાં અપીલ કરવામાં આવી છે.

"સતપંથ" ધર્મ પાળતા તેમજ ભરમાવે તેવા આંતરીક કે બાહ્ય આચરણના ભેદવાળી વ્યક્તિ કે સમૂહ તેમજ કેન્દ્રીય સમાજ દ્વારા અસ્વીકૃત સમાજ કે સંસ્થાનો સભ્ય યુવા સંઘના ત્રિસ્તરીય માળખામાં હોદ્દેદાર કે

યુવા સંઘના પ્રમુખપદે ગૌરાંગ ધનાણી

યુવાસંઘની તા.૧-૮-૨૦૧૦ના રોજ નવા બંધારણ અનુસાર પસંદગી સમિતિએ ભારતભરના સોળ રીજીયન દ્વારા નવ નિયુક્ત થયેલ સેન્ટ્રલ કેબીનેટ સભ્યો અને નિવૃત્ત થતા હોદ્દેદારો સાથે સંયુક્ત સભા બીલીમોરા ખાતે બોલાવેલ. બીલીમોરા સમાજવાડીના એરકન્ડીશન હોલમાં લગભગ સંપૂર્ણ હાજરીમાં આગામી વર્ષ ૨૦૧૦-૧૨ના નીચે મુજબના હોદ્દેદારોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવેલ. આ નવી પધ્ધતિને હાજર સર્વે સભ્યોએ આવકારી અને બિરદાવી હતી.

આ પસંદગી પામેલ કેન્દ્રીય હોદ્દેદારોને નખત્રાણા ખાતે મળનાર તા.૨૭-૮-૨૦૧૦ની સામાન્ય સભામાં શપથવિધિ અને કાર્યભાર સોંપણી કરવામાં આવશે. કાર્યશાળા નક્કી થયેથી સ્થળ જણાવવામાં આવશે.

નવા હોદ્દેદારો

ગૌરાંગ ધનાણી	કડોદરા	સેન્ટ્રલ પ્રેસીડેન્ટ
જયંતી રામાણી	અમદાવાદ	તત્કાલીન સેન્ટ્રલ પ્રેસીડેન્ટ
લીલાધર સુરાણી	નાગપુર	વાઈસ પ્રેસીડેન્ટ
ભરત જાદવાણી	બીલીમોરા	કાઉન્સીલ પ્રેસીડેન્ટ
અશોક ભાવાણી	ધનસુરા	કાઉન્સીલ પ્રેસીડેન્ટ
માવજી દિવાણી	નાસિક	કાઉન્સીલ પ્રેસીડેન્ટ
પ્રેમજી ધોળુ	નાગલપર	કાઉન્સીલ પ્રેસીડેન્ટ
શંકર રવાણી	જયપુર	કાઉન્સીલ પ્રેસીડેન્ટ
હરેશ રામાણી	બારડોલી	જનરલ સેક્રેટરી

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1400/page/n7/mode/1up

2010-08 -Patidar Saurabh (1400)

PATIDAR SAURABH (Monthly)

Regd. No. GKCH / 88-A / 2009-2011
RNI No. GUJGUJ / 2001 / 6356

realpatidar.com

Printed, Published and owned by Neeta Patel and printed at Allied Offset, Gomtipur - Ahmmedabad and Published at Nakhatrana (Kachchh). Editor : C.K. Patel.

Sweta Offset Pvt. Ltd. Ph. : 22940375